



ગુજરાત જાહેર સેવા આયોગ

Frequently Asked Questions (FAQs) for downloading of Call Letters

1	મારો કન્ફર્મેશન નંબર ખોવાઈ ગયેલ છે તો શું હું મારો કોલ-લેટર ડાઉનલોડ કરી શકીશ?
જવાબ	કોલ લેટર ડાઉનલોડ કરવા માટે કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ બંને જરૂરી છે. કન્ફર્મેશન નંબર મેળવવા માટે તમારો એપ્લિકેશન નંબર અથવા મોબાઇલ નંબર અને જન્મ તારીખ જરૂરી છે. કન્ફર્મેશન નંબર મેળવવા માટે અહીં આપેલ લિંક પર ક્લિક કરો અને વિગતો મેળવો. https://gpsc-ojas.gujarat.gov.in/KnowConfirmationNo.aspx?opt=wgtAwyTJIQM=
2	હું https://gpsc-ojas.gujarat.gov.in/ વેબસાઈટ પર તમામ વિગતો ભરું છું છતાં કોલ લેટર ડાઉનલોડ નથી થઈ રહ્યો. 'Application Not Found' એવી Error આવે છે. તો મારે શું કરવું જોઈએ?
જવાબ	આપે ભરેલ ફી નું ચલણ અથવા ઓનલાઇન ફી પેમેન્ટની રીસીપ્ટ અથવા બેંક પાસબુક/સ્ટેટમેન્ટ જેમાં ફીના પૈસા ભરવા અંગેનો ટ્રાન્સક્શન દર્શાવેલ હોય તેનો Photo/PDF આયોગના ઇ-મેઇલ એડ્રેસ ps2sec-gpsc-ahd@gujarat.gov.in પર મોકલવી સાથે ઇ-મેઇલમાં આપનો Confirmation Number, નામ વગેરે વિગતો પણ લખવી અને આપે ઓનલાઇન ભરેલ અરજી-પત્રકનો Photo/PDF અટેચ કરવો. સામાન્ય રીતે, 24 કલાકમાં આપનો કોલ-લેટર Unlock થઈ જશે. આવો ઇ-મેઇલ મોડામાં મોડો પરીક્ષાની તારીખથી બે દિવસ પહેલા કરવો જરૂરી છે.
3	હું અનામત વર્ગનો ઉમેદવાર છું. મારો કોલ લેટર મેળવવાં જતા 'Application Not Found' એવી Error આવે છે. તો મારે શું કરવું જોઈએ?
જવાબ	આપે જો બે વખત અરજી કરેલ હોય તો છેલ્લે (Latest) કરેલ અરજીનો કન્ફર્મેશન નંબર ધ્યાને લેવો. જો તેમ છતાં Error આવે તો આયોગના ઇ-મેઇલ એડ્રેસ ps2sec-gpsc-ahd@gujarat.gov.in પર આપની ઓનલાઇન અરજીની PDF/ImageAttach કરીને ઇ-મેઇલ કરવો. સામાન્ય રીતે, 24 કલાકમાં આપનો કોલ-લેટર Unlock થઈ જશે. આવો ઇ-મેઇલ મોડામાં મોડો પરીક્ષાની તારીખથી બે દિવસ પહેલા કરવો જરૂરી છે.
4	પરીક્ષાના દિવસે હું મારો કોલ લેટર લીધા વિના મારા પરીક્ષા કેંદ્ર ખાતે પહોંચી ગયો છું. શું હું પરીક્ષા આપી શકીશ?
જવાબ	ના, કોલ લેટર વિના પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહિ. પરીક્ષાખંડમાં પ્રવેશ માટે કોલ લેટરની હાર્ડ-કોપી જરૂરી છે. તે માટે ડિજિટલ કોપી માન્ય રહેશે નહિ. ઉમેદવારે કોલ લેટરની એક કરતા વધુ નકલો સાથે રાખવી. જેથી, તેઓને છેલ્લી ઘડીએ મુશ્કેલી ન વેઠવી પડે.
5	હું મારો કોલ લેટર ક્યાં સુધી ડાઉનલોડ કરી શકીશ?
જવાબ	સામાન્ય રીતે પરીક્ષાના સમયથી બે કલાક પહેલા સુધી કોલ લેટર ડાઉનલોડ થઈ શકે છે. પરંતુ ઉમેદવાર માટે એ હિતાવહ છે કે તેઓ તુરંત કોલ લેટર ડાઉનલોડ કરી લે અને તેને પ્રિન્ટ કરીને એકથી વધુ નકલો પોતાની સાથે રાખે.